



## Children's University

Subhash Chandra Bose Shikshan Sankul,  
Near Chh-5 Children's University Circle, Sector-20, Gandhinagar-382021  
Phone no: (079) 23244569 www.cugujarat.ac.in

### જનરલ સૂચનાઓ

- 1) ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય કોન્વોકેશન ૨૧-૦૪-૨૦૨૨ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાશે.
- 2) દરેક વિદ્યાર્થીઓએ સ્વખર્ચે કોન્વોકેશનમાં હાજર રહેવું.
- 3) પોતાનું કોઈ પણ એક ઓળખકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.
- 4) કોન્વોકેશનના દિવસે રજિસ્ટ્રેશન કરાવતી વખતે **Payment Receipt** સાથે રાખવી ફરજિયાત છે.
- 5) કોન્વોકેશનના દિવસે વેક્સીનેશન સર્ટિફિકેટ (ડીજીટલ) સાથે રાખવું ફરજિયાત છે.
- 6) વેબસાઈટ પર મુકેલું **Self-Declaration Form of Covid-19** ભરીને સાથે લાવવાનું રહેશે.
- 7) જે વિદ્યાર્થીઓ કોન્વોકેશનમાં ડિગ્રી લેવા માટે હાજર રહેવાના હશે તેઓએ યુનિવર્સિટીએ માન્ય કરેલો ડ્રેસ પહેરવાનો રહેશે. જે ડ્રેસની વ્યવસ્થા યુનિવર્સિટી કરશે.
- 8) કોન્વોકેશનમાં યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવે તે ડ્રેસકોડમાં જ દરેક વિદ્યાર્થીએ આવવાનું રહેશે અન્યથા પ્રવેશ આપવામાં આવશે નહીં.
- 9) કોન્વોકેશનના દિવસે ૮.૦૦ થી ૯.૦૦ વાગ્યા દરમિયાન હાજર રહી દરેક વિદ્યાર્થીએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે સાથે કીટ પણ મેળવી લેવાની રહેશે. જે વિદ્યાર્થીએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલ નહીં હોય તેને પ્રત્યક્ષ ડીગ્રી આપવામાં આવશે નહીં.
- 10) ડિગ્રી/ગોલ્ડમેડલ લેવા આવનાર દરેક વિદ્યાર્થી સાથે પરિવારના ફક્ત એક જ સભ્ય હાજર રહી શકશે.
- 11) કોન્વોકેશન દરમિયાન સંપૂર્ણ શિસ્ત જાળવવી ફરજિયાત છે.
- 12) વિદ્યાર્થીઓએ એક કલાક પહેલા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું અનિવાર્ય છે.
- 13) વિદ્યાર્થીઓ માટે નક્કી કરેલ સીટ નંબર પર જ વિદ્યાર્થીઓએ સ્થાન ગ્રહણ કરવાનું રહેશે.
- 14) વિદ્યાર્થીઓ કોન્વોકેશન ફંક્શન પૂર્ણ ન થાય તે પહેલા પોતાનું સ્થાન છોડી શકશે નહીં.
- 15) કોન્વોકેશન દરમિયાન વ્યક્તિગત ફોટોગ્રાફી અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે
- 16) ગર્વમેન્ટની ગાઈડલાઈન મુજબ VIP માટેના પ્રોટોકોલને અનુસરવાનું રહેશે અને સુરક્ષાકર્મીઓને સહકાર આપવાનો રહેશે
- 17) વિદ્યાર્થીના કોઈપણ પ્રતિનિધિ/વાલી વિદ્યાર્થીના બદલામાં ડિગ્રી સર્ટી/મેડલ લઈ શકશે નહીં. આ સંજોગોમાં તેમની ડિગ્રી પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે.
- 18) જે વિદ્યાર્થીઓએ Online Registration Form માં હાજર રહેવા માટેની સંમતિ નથી આપેલી તેઓ કોન્વોકેશનમાં પ્રવેશપાત્ર નથી.
- 19) જે વિદ્યાર્થીઓ કોન્વોકેશનમાં હાજર નથી રહેવાના તેઓને માત્ર ડિગ્રી સર્ટી પોતાના રજીસ્ટર્ડ સરનામે મળશે.
- 20) વિદ્યાર્થીઓ તેમજ કોન્વોકેશનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ 'પ્રતિજ્ઞા', 'યુનિવર્સિટી ગીત', અને 'રાષ્ટ્રગાન' વખતે પોતાની જગ્યા પર ઉભા રહેવું.
- 21) કોવિડ-૧૯ની સરકારની વખતોવખતની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.